Essen Speciality Films Limited

Formerly known as Essen Speciality Films Private Limited

Regd. Office Survey No. 192, Plot No. A, Industrial Area, Behind Orchev Pharma, Veraval (Shapar), Rajkot - 360 024 Guiarrat - India

Phone : +91 98253 12701

E-mail : info@essenspeciality.com

Website : www.essenspeciality.com

CIN : L24224GJ2002PLC041119

GSTIN : 24AABCE2983N1ZC



October 30, 2024

To,

National Stock Exchange of India Limited

The Listing Department Exchange Plaza, C-1, Block - G, Bandra-Kurla Complex, Bandra (East), Mumbai - 400 051

NSE Symbol: ESFL

Subject: Submission of Newspaper clippings of Notice of Postal Ballot and E-voting

Information

Reference: Regulation 47 of the Securities and Exchange Board of India (Listing

Obligations and Disclosure Requirements) Regulations, 2015 ("SEBI Listing

Regulations")

Dear Sir/ Madam,

With reference to the captioned subject and pursuant to Regulation 47(1)(d) and 47(3) of SEBI Listing Regulations, please find enclosed copy of newspaper clippings of Notice of Postal Ballot and Information on remote e-voting which has been published today i.e. Wednesday, October 30, 2024 in following newspapers:

- 1. "Economic Times" English Language Daily
- "Navgujarat Samay" Gujarati Language Daily

Copy of newspaper clippings shall also be available on the website of the Company at https://www.essenspeciality.com/investorszone.html

We request you to kindly take the above information on record.

Thanking You.

Yours Faithfully,

For, ESSEN SPECIALITY FILMS LIMITED

Pallav K. Doshi Chairman and Whole-time Director DIN: 02542047

Encl: a/a

Around the World

Russia Seizes Two Ukrainian Towns in its 'Fastest Advance'

Moscow | Kyiv: Russia said on Tuesday it had taken two eastern Ukrainian towns and open-source data indicated that Moscow's forces were advancing at their fastest pace in at least a year amid signs the conflict is drawing in new players such as North Korea.

The two-and-a-half--year-old war in Ukraine is entering what Russian analysts say is its most dangerous phase as Moscow's forces advance, North Korea sends troops to Russia and the West ponders how the conflict will end.

Russia said its forces had seized control of the town of Selydove, which had a population of 20,000 before the war and had been under sustained attack over the last week. Russian Defence Minister Andrei Belousov also congratulated Russia's 114th motorised rifle brigade on taking Hirnyk, which had a pre-war population of over 10,000 and lies about 12 km from Selydove.

Ukraine's military did not comment directly on the Russian claims but reported 31 combat clashes on the Pokrovsk front during the past 24 hours, including near Selydove. Ukraine's Deep State opensource intelligence map showed part of Selydove as being under Russian control, with about a third as a grey zone.

FASTEST ADVANCE

dent Vladimir Putin ordered into Ukraine in February 2022, advanced in September at their fastest rate since March 2022, according to open-source data, despite Ukraine taking a part of Russia's Kursk region. But during the week of Oct. 20-27, Russia made even bigger

Russian forces, which Presi-

20-27, Russia made even bigger gains - taking 196.1 square km of Ukrainian territory, according to the Russian media group Agentstvo which analysed Ukrainian open-source maps.

Russian drones and bombs smashed into Kyiv and Kharkiv, Ukraine's biggest cities, in nighttime attacks, killing four people and wounding 15 in a continuing aerial onslaught. Ukraine authorities said Tuesday. A Russian aerial attack struck Kharkiv, in Ukraine's northeast, killing four people, regional Gov. Oleh Syniehuboy said. Nearly 20 houses we re damaged in the attack, he said. Several hours earlier, Russia dropped a glide bomb on the landmark Derzhprom building in Kharkiv city center, injuring seven people, Mayor Ihor Terekhov said.

Russia controls Crimea, which it annexed from Ukraine in 2014, about 80% of the Donbas. **Agencies**

Apple Set for Biggest Revenue Jump in Two Years

Apple is expected to report its biggest quarterly revenue jump in two years on Thursday, with iPhone demand faring better than recent years toward the end of the company's annual release cycle, especially in

The results will provide investors the first hints of demand for the latest iPhone 16 series, which was rele-

ased a few days before the end of the company's fiscal fourth quarter.

But the focus will be on executive commentary for its fiscal first quarter amid fears that releasing its Apple Intelligence features at a slow pace could dampen a much-awaited AI-

led "super-cycle" for Apple's biggest seller. The company is playing catch-up in AI as Android smartphone rivals such as Samsung Electronics and software rivals such as Microsoft aggressively roll out applications aimed at tapping the generative AI boom. "The strength of the iPhone 16 cycle is the most important question heading into both the December quarter and FY25," Bernstein analyst Toni Sacconaghi said.

"Investors should expect Apple to be upbeat about iPhone 16 and Apple Intelligence, but it may or may not necessarily reflect the ultimate success of the cycle."

The company on Monday started a limited rollout of the features to U.S. customers in English, weeks after the iPhone 16 went on sale.

For now, Apple Intelligence will re-

main unavailable in key markets including Europe and China, where the tech giant is under pressure from a resurgent Huawei, as well as other domestic players such as Vivo,

other domestic players such as Vivo, Xiaomi and Honor.

That has raised worries that customers may push device purchases

from the all-important holiday sea-

son to next year, delaying a potential

boost to sales from AI. In the September quarter, Apple is expected to report a 3.8% increase in

expected to report a 3.8% increase in iPhone sales, according to analysts' estimates compiled by LSEG. That would snap two quarters of decline. Its overall revenue is expected to rise 5.7% in the July-September pe-

urth quarter, LSEG data showed. Revenue from Greater China is expected to rise 6.6%. Some iPhone models, including a version of the iPhone 16 Plus, had discounts of 10%

riod, which makes up its fiscal fo-



GHCL Textiles Limited

Registered Office: GHCL House, Opp. Punjabi Hall, Near Navrangpura Bus Stand, Navrangpura, Ahmedabad-380009, Gujarat.

Phone: 079-26427519, Website: www.ghcltextiles.co.in Email: info@ghcltextiles.co.in, secretarial@ghcltextiles.co.in (CIN: L18101GJ2020PLC114004)

EXTRACT OF UNAUDITED FINANCIAL RESULTS FOR THE QUARTER AND SIX MONTH ENDED SEPTEMBER 30, 2024

(INR in Crores)

		(INIX III CIOLES)				
Sr. No.	Particulars	Quarter Ended	Six Months Ended	Quarter Ended		
		30.09.2024	30.09.2024	30.09.2023		
		Unaudited				
1	Total Income from operations	306.65	595.43	261.18		
2	Net Profit from ordinary activities after finance costs but before exceptional items from operations	15.92	31.61	8.37		
3	Net Profit before tax from operations (after Exceptional and/or Extraordinary Items)	15.92	31.61	8.37		
4	Net Profit after tax from operations (after Exceptional and/or Extraordinary Items)	20.60	32.40	6.15		
5	Other Comprehensive Income	0.36	0.72	-		
6	Total Comprehensive Income (after tax)	20.96	33.12	6.15		
7	Paid Up Equity Share Capital (face value of INR 2/- each)	19.12	19.12	19.12		
8	Other Equity as per the audited balance sheet					
9	Earnings per share (face value of INR 2/- each)	(Not Annualised)				
	Basic and Diluted	2.15	3.39	0.64		

Note: The above is an extract of the detailed format of Quarterly / Annual financial results filed with the stock exchange under regulation 33 of the SEBI (listing obligations and disclosure Requirements) Regulations, 2015. The full format of the Quarterly / Annual financial results are available on the website of BSE Limited (URL: www.bseindia.com/corporates), the National Stock Exchange of India Limited (URL: www.nseindia.com/corporates) and on the company's website (URL: https://ghcltextiles.co.in/investors/financial-reports/).

Noida October 29, 2024



For and on behalf of Board of Directors of GHCL Textiles Limited Anurag Dalmia Chairman



GUJARAT AMBUJA EXPORTS LIMITED NURTURING BRANDS




STANDALONE FINANCIAL HIGHLIGHTS FOR THE QUARTER AND HALF YEAR ENDED $30^{\rm TH}$ SEPTEMBER, 2024

HALFTEAR	ENDED SU SEFT	ENIDER, 2024		(₹ in Crore	
HIGHLIGHTS	QUARTE	R ENDED	HALF YEAR ENDED		
	30.09.2024	30.09.2023	30.09.2024	30.09.2023	
Net Sales	1124.64	1115.72	2215.08	2278.71	
EBITDA	129.96	145.68	264.53	274.36	
Cash Profit Before Tax	125.70	139.81	256.88	262.32	
Profit Before Tax	94.45	109.32	194.81	201.53	
Profit After Tax	69.53	82.99	146.27	153.86	
Cash Profit After Tax	100.78	113.48	208.34	214.65	
EPS (diluted) - in ₹ per share (Face Value of ₹ 1/-)	1.52	1.81	3.19	3.35	

Regd. Office: "AMBUJA TOWER", Opp. Sindhu Bhavan, Sindhu Bhavan Road, Bodakdev, P.O. Thaltej, Ahmedabad - 380 054.
Ph.: +91 79 6155 6677, Fax: +91 79 6155 6678, Email: info@ambujagroup.com

CIN: L15140GJ1991PLC016151

Note: This is not a statutory advertisement. For detailed financial results, please refer our website www.ambujagroup.com



Essen Speciality Films Limited

(Formerly known as Essen Speciality Films Private Limited)

Regd. Office: Survey No. 192, Plot No. A, Industrial Area,
Behind Orchev Pharma, Veraval (Shapari), Rojkot, Gujarat - 360024, India
Contact: +91 98253 12701 | E-mail: compliances@essenspeciality.com

ESSEN® SPECIALITY FILMS LTD

Website: www.essenspeciality.com | CIN: L24224GJ2002PLC041119 POSTAL BALLOT NOTICE AND E-VOTING INFORMATION

Notice is hereby given pursuant to the provisions of Section 110, and other applicable provisions of the Companies Act, 2013, as amended (the "Act"), read together with the Companies (Management and Administration) Rules, 2014, as amended (the "Management Rules"), General Circular Nos. 14/2020 dated April 8, 2020, 17/2020 dated April 13, 2020, 20/2020 dated May 5, 2020, 22/2020 dated June 15, 2020, 33/2020 dated September 28, 2020, 39/2020 dated December 31, 2020, 10/2021 dated June 23, 2021, 20/2021 dated December 8, 2021, 3/2022 dated May 5, 2022 and 11/2022 dated December 28, 2022, issued by the Ministry of Corporate Affairs, Government of India (the "MCA Circulars"), Secretarial Standard on General Meetings issued by the Institute of Company Secretaries of India ("SS-2") and any other applicable law, rules and regulations (including any statutory modification(s) or re-enactment(s) thereof, for the time being in force), to transact the items of special business as set out in the Postal Ballot Notice dated October 28, 2024 proposed to be passed by the Members of Essen Speciality Films Limited ("Company") (as on the Cut-off Date), through Postal Ballot by voting through electronic means ("remote e-voting") only.

In compliance with Regulation 44 of the Securities and Exchange Board of India (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015, as amended (the "Listing Regulations") and pursuant to the provisions of Sections 108 and 110 of the Act read with the rules framed thereunder and the MCA Circulars, the manner of voting on the proposed resolution is restricted only to e-voting i.e., by casting votes electronically instead of submitting postal ballot forms. Accordingly, the postal ballot notice and instructions for e-voting are being sent only through electronic mode to those Members whose email address is registered with the Company/depository participant(s).

In compliance with the provisions of Section 108 and Section 110 of the Act read with Rule 20 and 22 of the Rules, Regulation 44 of the Listing Regulations, and SS-2, the Company is pleased to provide e-voting facility to its Members, to enable them to cast their votes electronically. The detailed procedure with respect to e-voting is mentioned in Postal Ballot Notice. The Company has engaged the services of Bigshare Services Private Limited ("BIGSHARE") for facilitating e-voting. The Company has made necessary arrangements with Bigshare Services Private Limited, Registrar and Share Transfer Agent ("RTA") to enable the Members to register their e-mail address. Those Members who have not yet registered their e-mail address are requested to register the same by following the procedure set out in Postal Ballot Notice.

The e-Voting period will begin on Wednesday, October 30, 2024 at 9.00 a.m. IST and will end on Thursday, November 28, 2024 at 5.00 p.m. IST. Members desiring to exercise their vote through the e-voting process are requested to carefully read the instructions indicated in this Notice and record their assent (FOR) or dissent (AGAINST) by following the procedure as stated in the Notes forming part of the Postal Ballot Notice. During this period, the shareholders of the Company as on the cut-off date i.e. October 25, 2024 may cast their vote electronically. The e-Voting module shall be disabled by Bigshare for voting thereafter.

Pursuant to Rule 22(5) of the Rules, the Board of Directors of your Company at its meeting held on October 28, 2024, has appointed CS Nirav D. Vekariya, Practicing Company Secretary (Membership No. F11660, CP No. 17709), as the Scrutinizer ("Scrutinizer") for conducting the Postal Ballot/e-voting process in a fair and transparent manner.

The Scrutinizer will submit his report to the Chairman or any other person authorized by the Chairman after the completion of scrutiny of the e-voting, and the result of the e-voting by Postal Ballot will be announced not later than 48 hours from the conclusion of e-voting and will also be displayed on the Company website https://www.essenspeciality.com, on the website of BIGSHARE https://ivote.bigshareonline.com, and communicated to National Stock Exchange of India Limited where the shares of the Company are listed.

In case of any queries regarding e-Voting, you may refer the Frequently Asked Questions ('FAQs') and i-Vote e-Voting module available at https://ivote.bigshareonline.com, under download section or you can email to ivote@bigshareonline.com or call at: 1800 2254 22.

Date :- October 29, 2024

Place :- Veraval (Shapar)

For, Essen Speciality Films Limited
(Formerly known as Essen Speciality Films Private Limited)

Sd/-Pallav K. Doshi Chairman & Wholetime Director DIN : 02542047



સરકારના કરોડોના પ્રીમિયમની ચોરીઓ કરનારા ભુમાફિયાઓ સામે 'ઓપરેશન ગંગાજળ' દાહોદના નકલી NA કૌભાંડમાં 112 સર્વે નંબરોની યાદી સાથે 75 આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધાયો

■દાહોદમાં અતિ સ્ફોટક બની ગયેલા નકલી બિન ખેતીના હુકમોના આધારે સરકારના કરોડો રૂપિયાની પ્રીમિયમની યોરીઓ કરીને વિશ્વાસથાત અને ઠળાઈ કરનારા એ ભુમાકિયાઓ સરકાર સામે " ઓપરેશન ગંગાજળ" જેવી હાથ ધરાયેલી સખ્ત કાર્યવાહીઓમાં દાહોદ તાલુકા પંચાયતમાં કરજ બજાવતા કર્મચારી મહેશકુમાર ભગુભાઈ પટેલ કારા 112 સર્વે નંબરોની જમીનોમાં દાહોદ તાલુકા પંચાયત કચેરીના સહી સિક્કાઓ સાથેના નકલી બિન ખેતીના હુકમો તૈયાર કરવાના ચોંકાવનારા પ્રકરણમાં 75 આરોપીઓના નામજોગ ાથા તેઓના મળતિયાઓ સામે દાહોદ એ ડિવિઝન પોલીસ મથકમાં કરિયાદ આપી છે. પોલીસ તંત્રએ આ તમામ આરોપીઓ સામે ગુનો દાખલ કરતા

આનંદના તહેવારો હૈયાહોળીઓના માહોલમાં ફેરવાઈ ગયા હોવાની ખબર ખબરોથી સમગ્ર દાહોદ શહેરમાં સ્તબ્યતા પ્રસરી જવા પામી આવી છે. આ ક્રીભાંડમાં જેની સામે ગુનો નોંધાયો છે તેવા 75 આરોપીઓમાં સામેલ કેટલાક વગદાર ભુમાકીયાઓ દ્વારા દાહોદ તાલુકા પંચાયત કચેરીના નામ ના નકલી બિન ખેતીના હુકમો ના આધારે મિલકત ખરીદ કરનારા ગ્રાહકો સાથે કરોડો રૂપિયાના વ્યાપારો કરીને શહેરમાં અમીચંદ બને કરતા આ ચહેરાઓ આરોપીઓ બની જતા સમગ્ર શહેરમાં ચકચાર પ્રસરી જવા પામી છે. ગુજરાત સરકારને હચમચાવી દેનારા

દાહોદ ના બહુચર્ચિત નક્લી બિન ખેતીના હુકમો ના આધારે સરકારના કરોડ્રે રૂપિયાના પ્રીમિયમની ચોરીઓ કરવાના પોલિટિકલ પાવર ફુલ પ્રોટેકશન

આણી મંડળીના ભુમાફીયાઓ ના કરતુકો સામે દાહોદ કલેક્ટરાય કચેરી દ્વારા શરૂ કરવામાં આવેલ સખ્ત તપાસોમાં 219 જેટલા સર્વે નંબરો ને બ્લેક લિસ્ટ કરાયા હતા. એમાં સૌથી વધુ 197 સર્વે નંબરોમાં દાહોદ તાલુકા પંચાયત કચેરી ના નામ માં 2016 થી 2020 ના સમયગાળ દરમિયાન નકલી બિનખેતીના હુકમો ના આધારે દાહોદ સીટી સર્વે કચેરીમાંથી પ્રોપર્ટી કાર્ડ જનરેટ કરાવીને સરકારના કરોડો રૂપિયાના પ્રીમિયમ ની ચોરીઓ કરી હોવાના સ્ફોટક કૌભાંડ નો પર્દાફાશ

જો કે સમગ્ર ગુજરાતને આચમચાવી જા કે કામમાં ગુજરાતા વાતાનવાના કેનારા અપે ડિવિઝન પોલીસ મથકમાં 112 સર્વે કરવા બદલ હરિયાદ આપતા કેનારા દાહોદ ના અગ્રેસર કહેવાતા એ ડિવિઝન પોલીસ મથકમાં 112 સર્વે કરવા બદલ હરિયાદ આપતા નકલી બિન ખેતીના હુકમોના બહાર નંબરોની યાદી સાથે 75 આરોપીઓના એ ભૂમાફિયાઓના નકલી આવેલા સ્ક્રોટક જમીન કોર્માડો સામે નામ જોગ દાહોદ તાલુકા પંચાયત કરેવી હુકમો તૈયાર કરવાના ક યાર દિવસો પૂર્વે 33 આરોપીઓ સામે ના સહી સિક્કાઓ સાથે તૈયાર કરાયેલા એતિહાસિક બની ગયા " ત્રક્ષ ગુનાઓ દાખલ કરાયા બાદ ગત નકલી બિન ખેતીના હુકમોના આપાર્ટ ચર્ચાઓ શરૂ થવા યાપી છે.

હવે ગુમ થઈ ગયેલા 82 સર્વે નંબરોના દસ્તાવેજી પુરાવાઓ સામે વધુ એક ગુનો દાખલ થવાની ચર્ચાઓ શરૂ

કહોદ તાલુકા પંચાયતામાં ગામમાં સૌથી વાલું છા જોકાસ્પદ સર્વે બંબરોમાં બિન ખેતીના કદવામાં આવેલા ફુકમો નકાવી હોવાનું બહાર આવતા વહીવટી તંત્રમાં બબરક્સ ખાબસ્પદ પસરી જવા પામકે હતો. 'મે કે નકાવી ભિખોરી ફુકમો સામે શકુ કરવામાં આવેલા તપાસો દરમિયાન હર શર્વે બંબરો ના દસ્તાવણ પૂચાવો દાઢીદ તાલુકા પંચાયતાની સરકારી કહેરી માંથી અતક્ષર થઇ ગયા હીવાનું તંત્રના શામાં પર આવ્યું હતું, તેમાં 112 સર્વે બાંબરોના નકાવી બિન ખેતીના ફુકમો સામે ગુનો દાખલ કરાયા બાદ હવે રા સર્વે બંબરોના એ મિલકત દાસકો સામે સરકારી કહેરી માંથી દરવાલેપુ પ્રમાબા સ્તંત્રએ કરવાની કલ્લમોના ઉમેરા સાથે વાંદુ એક ગુનો ગમે ત્યારે દાખલ કરાશે એવી. ચર્ચાઓ એ સંપ્ર પાસ્ત્ર મો ો વધુ 197 શેકાસ્પદ સર્વે નંબરોમાં જોર પકડ્યું છે.

મોડી સાંજે દાહોદ તાલુકા પંચાયતના કર્મચારી મહેશકુમાર પટેલ દ્વારા દાહોદ એ ડિવિઝન પોલીસ મથકમાં 112 સર્વે

પ્રદેશના પીષિયમની શોડીઓ કરીને સરકાર સાથે ઠગાઈ અને વિશ્વાસધાત કરવા બદલ ફરિયાદ આપતા દાહોદના એ ભુમાફિયાઓના નકલી બિનખેતી હુકમો તૈયાર કરવાના કરતુંકો " એતિહાસિક બની ગયા " હોવાની

વડોદરાની મંજુસર GIDCમાં ડમ્પર 11KV વીજવાયરને અડકી જતાં આગઃ બેનાં મોત

કચરો ઠાલવવા માટે HPCL ચોકડી પાસે ડમ્પરની ટ્રોલી ઊંચી કરતાંની સાથે આગ

નવગુજરાત સમસ > વડોદરા

🔤 પ્રેદરા જિલ્લાના સાવલી તાલુકાના મંજુસર GIDCમાં આવેલ HPCL ચોકડી પાસે ગટરમાં કચરો ખાલી કરતી વેળાએ વીજ વાયર અડકી જતા ડમ્પરમાં આગ લાગી ઉઠી હતી. જેમાં બે વ્યક્તિઓ આગમાં ભડ્યુ થઈ હતી, જ્યારે બે વ્યક્તિઓ ગંભીર રીતે દાઝી ગઈ હોવાની ઘટનાએ વિસ્તારમાં ચકચાર મચાવી મુકી છે.

મંજુસર પોલીસ મથકે કરિયાદી દીપક સિંહ રોશન સિંહ ચૌહાણ (હાલ રહે. પ્લોટ નંબર ૮૬૧/૧ રોયલ સ્ટીલ મકરપુરા જીઆઇડીસી વડોદરોના એ લગાવીને હાઇડ્રોલિક કરીને કચરો ખાલી પોતાની લેરમાદ નોંધાવી હતી. જેમાં કરતા હતા. તે વખતે કપર આગળ જગ્રાવ્યા અનુસાર મેગળવારે સવારે પાછળ કરતા અને હાઇડીલિક કરતા નવ વાગ્યાની આસપાસ પોતે તથા શેર બીડીને ઉપરથી પસાર થતી ઇલેક્ટ્રિસિટી



હુર્સન નાઓ પોતાના શેઠ નાઝીર હુરોન મોગલગારા નું ભારતબેઝ કંપનીનું ડમ્પર મકરપુરા જઆઇડીસી થી કચરો ભરીને મંજુસર GIDC ખાતે ગોડાઉનમાં નાખવા આવ્યા હતા. તે સમયે ગોડાઉન પર કામ કરતા સિક્યુરિટીએ ગોડાઉનની કમ્પાઉન્ડ દિવાલની બહારની જગ્યામાં કચરો ખાલી કરવા જણાવ્યું હતું. જેથી શેરરઝા રિયાઝ સિદીકી એ ડમ્પર બહાર ગટરમાં

નો વાયર અડી જતાં ટાયર માં આગ લાગી હતી. જેથી પોતે સળગતા ટાયર હોંગો હતો. જ્યાં પાતે સંગંગનો ટાપર ઉપર માટી નાખતા હતા જ્યારે મુલ્લો તથા પતન્ના નામના ઈસમો દૂર ઉભા હતા. તે વખતે મોમીન રજા ઉર્કે છોટું રિયાઝ સિદીર્ધ ડમ્પરને અડ્રી જતા તેને કરેટ લાગ્યો હતો અને ડ્રાઈવર શેર રઝ રિયાઝ સિદીકી ગાડીમાંથી નીચે ઉતરતો હતો ત્યારે તેને પણ કરટ લાગ્યો હતો અને હતા વારત વહે કરેટ લાગ્યા હતા અને સળગતા ડમ્પરમાં બંને ઈસમો સળગી ઊઠ્યા હતા આમ અચાનક ગાડીમાં આગ લાગવાથી અને પોતાના બંને મિત્રો સળગવાથી પોતે બેહોરા થઈ ગયા હતા અને હાજર જનોએ 108 મારકતે વડોદરા સારવાર અર્થે ખરોડ્યા હતા.

આ બનાવમાં (૧) શેરરઝા રિયાઝ સિક્ષીકી (૨) મોમીન ૨ઝા ઉર્ફે છોટુ રિયાઝ સિદ્દીકી (હાલ રહે, રોયલ સ્ટીલ મકરપુરા ત્તરાકા કાલવ તર, રાયલ તરાલ મકડપુરા જી આઈ ડી. સી વડોદરા) પ્લોટ નંબર ૮૯૫૧ બંને સગા ભાઈઓ નું કટ્ટેશ મૃત્યુ નિપબ્યું હતું જ્યારે બે ને સામાન્ય ઇજા થઈ હતી બનાવ ના સ્થળે મંજુસર પહેલીસ મામલતદાર સહિત ઘટના સ્થળે પહોંચ્યા હતા , પોલીસ હાલ અકસ્માત મોત રજીસ્ટર કરી તપાસ હાથ પરી છે

મુખ્યમંત્રીએ પૌત્ર સાથે ફટાકડા ફોડ્યાં.. वदेवारो हरें वोडी परिवार, स्वणनी સરાળતા અને નિખાલતાઓ પારેચલ કરો અંકવાર આપતા દિવાળીના તઠેવારોની દિવાળી કરી રહ્યાં છે. ભૂપેન્દ્ર પટેલ કોઇ જ ઓપશારિકતા દિના પોતાના લાકકલાલા પીત્ર શાંશે સામાન્ય માનવીની જેમ જ કરાકડા ખરીઇ કરવા દુકાનમાં પહોંચો ગયા હતા અને દેમારો પરિવારજનો સાથે ઉલ્લાસથી ફરાકડા ફોડીને

વાવનાં મીઠાવીરાણામાં સિંચાઈના પાણી મુદ્દે ચૂંટણી બહિષ્કારની ચીમકી

સમયથી સિંચાઈનું પાણી નહીં મળતાં આખરે કંટાળેલા ખેડૂતોએ યસદ નાયળ કલેક્ટરને આવેદનપત્ર આપી પાણી નહીં તો વોટ નહીંની ચીમકી આપી હતી, છેલ્લા ત્રણ વર્ષથી ખેડૂતો રજૂઆત કરી રહ્યા છે છતાં ૨૦ જેટલા ખેડૂતોને સિંચાઈનું પાણી ન મળતાં વાવ વિધાનસભાની પેટા ચંટણીને લઈને ગ્રામજનોએ ચંટણી જોવા મળી રહ્યો છે.

બહિલારની ચીમકી ઉચ્ચારતાં રાજકીય અને વહીવટી તંત્રમાં પણ દોડપામ મચી જવા પામી છે, સરાદ તાલુકાના ગાસીસર મુખ્ય શાખામાંથી તખતપુરા (જો) હાલ અપૂરી બંધ પડેલી હોવાથી સિંચાઈનું પાછી મળતું નથી. આથી આ કેનાદલે આગળ લંબાવી અથવા ગાસીસર મુખ્ય શાભામાંથી મીઠિદીવસારલ શાખાન 2 કેનાલનું કામ પણ અધુંદું છોડવામાં આવ્યું છે. તેને લંબાવી બાકી રહેતા ખુદ્દોને ભરશિયાર્થ સિંચાઈનું પાલી નહીં મળતા રોય એના આવી હારી

અમૂલ ડેરી દ્વારા ચરોતરની 750 દૂધ મંડળીમાં સોલાર પ્લાન્ટ કાર્યરત કરાયા

ખાતે સ્થાપિત સોલાર પ્લાન્ટનું ઉદઘાટન

નવગુજરાત સમય > આવંદ

અમુલ ડેરી એટલે ખેડા જિલ્લ સહકારી દૂધ ઉત્પાદક સંઘ લિ. દ્વારા આણંદ, ખેડા અને મહીસાગર જિલ્લામાં કાર્યક્ષેત્ર હેઠળ આવતી ૭૫૦ દૂધ મંડળીઓમાં સોલાર પ્લાન્ટ સ્થાપિત કરવામાં આવેલ છે. અને માર્ચ ૨૦૨૫ સુધીમાં સંઘની તમામ દૂધ મંડળીઓમાં સોલાર પ્લાન્ટ સ્થાપિત કરવામાં આવશે. અમૂલ ડેરીના ૭૮મા સ્થાપના દિવસ અને સરદાર પટેલની ૧૪૯મી જન્મજ્યંતિની ઉજવણી નિમિતે ક્લજરી અને કાપડીવાવ ખાતે સ્થાપિત સોલાર પ્લાન્ટનું ઉદયાટન રહ્યા હતા.અમુલ ડીના ચેરમેન વિપુલ એક મુદ્દે અનેક વખત ચર્ચા થઇ હતી કે કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત અમુલ પટેલે જણાવ્યું કે, ટીએમઆર પ્લાન્ટ આગામી ટ્રાબી 30 વર્ષ ભારતમાં ડેરી ટોટલ મિલ રાશન-ટીએમઆર પ્લાન્ટનું અત્યાધુનિક મશીનોથી સુસ્તુજ છે, જેમાં ઉદ્યોગના છે.



ઉદઘાટન કરવામાં આવ્યું હતું. અમૂલડેરીના૭૮માસ્થાપનાદિવસની ઉજવણીમાં ૨૦૦૦થી વધુ સંખ્યામાં દૂધ મંડળીના ચેરમેન અને સેક્રેટરી ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે મુખ્ય મહેમાનપદે એનવ્રિવ્રીબીના ચેરમેન વ્રે.મીનેશ શાહ, અમૂલ ડેરીના ચેરમેન વિપુલ પટેલ, વાઇસ ચેરમેન કાંતિભાઇ સોઠા પરમાર, મેનેજિંગ ડિરેક્ટર ડો.અમિત વ્યાસ તેમજ નિયામક મંડળના સભ્યો ઉપસ્થિત

ડિસ્પેન્સર, ટીએમઆર મિક્સચર તેમજ ઓટોમેટીક બેગ પેકિંગ મશીન સ્થાપિત કરેલ છે. આ પ્લાન્ટ ભારતમાં અમૂલ ડેરી ઢારા સૌપ્રથમ સ્પાપિત કરવામાં આવેલ છે. આગામી સમયમાં ઉદેલ ખાતે પણ ટીએમઆર પ્લાન્ટ સ્થાપવાની

અમૂલ ડેરી ભારતના બધા દૂધ સંઘમાં બધા જ ક્ષેત્રે આગળ છે અને સંઘમાં બધા જ ક્ષત્રે આગળ છે અને અમૂલ ડેરી દ્વારા ભવિષ્યનો ચિષવામાં આવે છે. ભારતભરમાં બધા કરતાં દૂધનો વધુ ભાવ અમૂલ ડેરી દ્વારા સભાસદોને યુક્રવવામાં આવે છે. એન્ડીડીબીના ચેરમેન ડો.મીનેશ શાહે જણાવ્યું કે, તાજેતરમાં પેરિસ ખાતે આયોજિત આઇડીએકની કોન્ફરન્સમાં

gradi d. G	विष्यां क्षाने स्वतः स्वयः विद्यः सूचनाक्षेत्रः सार्वःक्षेत्रः	September 1700se s Selection	तरी स (१ (संक्षिण (डोन नं: ज्ञासीपी	(one) meases	5), कांकावाडी विस o / १६०५ / १६ १४-२०२५ वासी सूथना	0.6	150
5.00 5.00	क्षात् वर्षाक वर्षाः वर्षाः अस्य अस्युं सम	German German German Separan S	भागवादा र अम् पूर्व इस्त्रमा सम्बन्धात	feffer entrin silveits souni anamai	विविधाः श्रीक्षरपानी श्रेकी तार्वित तथा समय	भा कार्य छ: निविश भोतवानी निवत तारीण तथा क्या	विकासका अव्यः (१)
4.	रैंड डेमाड, राम्याधारमा मा मेत वीरामाची कर्त वीवीरामाची डेटीन निरिटेंड जू नारीबीडरण - स्टिवा राम चीरावमा डावी	50/4 \$C'00	DE Hisan	१८.२५.१०११ वा १०.२० ५५५३० वा १८.२५.४०११ वा १८७० ५४४६ वुधी	84.54.808 #8 46.00 8685 flag	२५.२५.४०२४ जा १४:०० ठवके (२५:जीका वया प्रेमर्टिशक जोती)	és,rouj-

्रिकीत दरावर्षण विविद्यांत्रिकारोत तथा संभाव तथा स्थित अधिक पहुंच से पुत्रको प्रति स्थाव सुक्रम स्थावताना प्राथम अधिक कि स्थावताना प्राथम अधिक स्थावताना प्राथम अधिक स्थावताना प्रायम अधिक स्थावताना प्रायम अधिक स्थावताना प्रायम अधिक स्थावताना प्रायम अधिक स्थावताना स्थाताना स्थावताना स्य

ગાંધીનગર જિ.પં.માં 386લોકોએ પ્રકૃતિ પરીક્ષણનો લાભ લીધો



આયષ મંત્રાલય દ્વારા આ વર્ષની અધુષ મત્રાલય દ્વારા આ વષના રાષ્ટ્રીય આયુર્વેદ દિવસની થીમ "વૈચિક સ્વાસ્થ્ય માટે આયુર્વેદનું નવીનીકરણ" પર આયુષ નિયામકના માર્ગેદર્શન અને ગાંધીનગર જિલ્લા વિકાસ અધિકારીની અધ્યક્ષતામાં જિલ્લા આયુર્વેદ અધિકારી અધ્યક્ષતામાં જિલ્લા આયુર્વેદ અધિકારી વૈદ્ય ભાવના પટેલની આગેવાની હેઠળ વચ ભાવના પટકાના આગવાના હઠળ નવમા રાષ્ટ્રીય આયુર્વેદ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. તે નિમિત્તે ધનવંત્તરિ યક્ષ, આયુષ પ્રદર્શન અને પ્રકૃતિ પ્રદર્શન કેમ્પનું આયોજન કરાયું હતું. તેમાં પ૯૦થી વધુ લોકોએ આયુર્વેદ પ્રદર્શનનો લાભ લીધો હતો. જ્યારે ૩૮૬ લોકોએ પ્રકૃતિ પરીક્ષણ કરાવી જીવન શૈલી પરિવર્તન અંગે માર્ગદર્શન મેળવ્યું હતું.

આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ શિલ્યાબેન પટેલ, ધારાસભ્ય રીટાબેન પટેલ, ગાંધીનગરના મેયર મીરાબેન પટેલ, જિલ્લા આરોગ્ય સમિતિ ચેરમેન

જયાબેન ઠાકોર, શિજાણ સમિતિ ારમેન હસાબેન પટેલ, મ્યુનિ. સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ગૌરાંગ વ્યાસ, ભાજપ અગ્રણી જવેશભાઈ પટેલ, ગાંધીનગર એપીએમસી ચેરમેન ઇન્દ્રવદનભાઈ પટેલ, સંજયભાઈ ઠાકોર, કો-ઓપ્ટ સદસ્યો, નાયબ નિયાયક અલ્પેશભાઈ જરસાક્ષિયા, નાયબ નિયાયક રીસર્ચ અને તાલીમ કાલ્યુનભાઈ પટેલ, સ્ટેટ સંશોધન અધિકારી ડો. મિતેષ પ્રજાપતિ અને રીલીવિંગ મેડિકલ ઓફિસર ડો. દિનેશ ચૌધરી હાજર રહ્યા હતા.

આ ઉપરાંત કોલવડા આયુર્વેદ હોસ્પિટલ-કોલેજમાં પણ નવમા રાષ્ટ્રીય આયર્વેદ દિવસની ઉજવણી નિમિત્તે ધનવંતરી યક્ષનું આયોજન કરાયુ હતુ. તેમાં મેયર મીરાબેન પટેલ, ગાંધીનગર ઉત્તરના ધારાસભ્ય રીટાબેન પટેલ રાજ્યના આયુષ વિભાગના નિયામક જયેશભાઇ પરમાર સહિતના અગ્રશીઓ જોડાયા હતાં.

प्रको बैंक 👩 UCO BANK अวया ओर्डओ छे

कार्वर निविद्य नं. १४ सने २०२४ -२५

ગુલાંક સામાના રોમાપામાં હતા કારવામાં આ કારવામાં ૧૯ ૧૯, વર્ષા માના માના (૧૯૧૬) કારા ૧૯૦૦ ને લે - તું. આતામી અન્ય (આપ્યું), અમાત્રામાં - ૧૯૦૦ માં કોર ન (૧૯૯) કારા ૧૯૦૦ ને લીધો લીધો સ્થાન કર્યા કાર્ય અને માના કિમાનાની લોગાં લીધીનો લીધોમાં ઈપકારાસભીએ પાંચીની લોધો સ્થાન કર્યા અને લાધાની લીધો સ્થાન કર્યા કરાય કર્યા કરમા કર્યા કર્યા કર્યા કર્યા કર્યા કર્યા કર્યા કર્યા કરમા કર્યા કરમા કર્યા કર્

www.statetenders.gujarat.gov,in પર જોવા મળાં. કાર્યો અંધે વધુ હિ માત્રજના દિવસો દાખ્યાન ઉપરાંતન ક્ષેત્રીઓ ક્ષેત્રક માત્રવાની મળી શક્યો.



AHMEDABAD MUNICIPAL CORPORATION

Ahmedabad Zoo, Kankaria, Maninagar, Ahmedabad-380008

Selection of Consultant for Preparation of Master Plan Proposal of Kamia Nebru Zoological Garden at Kankaria, Ahmedabad, Gujarat

RFQ Notice No. 03/2024- 25 Zoo Department

RFQ Notice No. 03/2024-25 Zoo Department
AMC through the Ahmedabad Zoo Department Intends to select
duly qualified firms for the captioned task for preparation of the
Master plan, Proposals are invited from reputed parties with the
necessary qualifications and capabilities through tendering.
The party should be a minimum of 5 years' experience hedian
consultancy 2 agency. (Firm with a minimum annual average
turnover of 10,00,000- (Ten Lakhs only) and completed one
(1) similar assignment of medium/Large size zoo incorporating
the approval of Central Zoo Authority (CZA) for the same project
in last 10 years. The details shall be submitted online and offline.
Interested parties may download tender documents through
https://tender.projecure.com s. www.ahmedabadcity.gov.in. Interested parties may download tender documents through https://tendes.procure.com & www.ahmedabactik.gov.in from 30:10/2024 to 19/11/2024. The online submission of the bid from Dt. 30/10/2024 to Dt.19/11/2024 by 18.00 hts., on thttps://tender.aprocure.com. The Pre-bid meeting, shall be held on 11/11/2024 at 13:00 hrs. The physical bid is to be submitted between 19/11/2024 (during office hours) and 20/11/2024, up to 13:00 hrs. To the Tender Office, contral Record Office, old building, Sarafar Pattle Bhavan, Khamasa, Danapith Ahmedabad -3800°T only after online submission. The opening of the physical bid will be on Dt. 20/11/2024 at 15:00 hrs.

Deputy Municipal Commissioner (Zoo / SZ)

जंलातना युवडनो સુરતમાં ગળેફાંસો ખાઈ આપદાત

■નુટતમાં ભાદા વિસ્તારમાં રહેતા રદ્દ વર્ષીય નોકરિયાત યુવાને ગળકાંસો ખાઇ આપધાત કરી લીધો હતો. યુવકે કયા કારશે આપધાતનું પગલું ભયું તે અંગે હાલ રહસ્ય સર્જાયું છે.

અગ હાલ રહસ્ય સજાયુ છ. મૂળ ખંભાતના વતની અને હાલ પાલ ભાઠા વિસ્તારમાં આવેલા કિનાર હાઈટ્સમાં રદ વર્ષીય પ્રણવ કમલેશભાઈ પટેલ માતા-પિતા ગપારાભાઇ પટલ પાતાપામાં સહિતના પરિવાર સાથે રહેતો હતો. પ્રણવ શેર-માર્કેટમાં નોકરી કરી પરિવારને આર્થિક રીતે મદદરૂપ થતો હતો. ગઈકાલે ભપોરે પ્રણવે ઘરે છતન લોખંડના હુક સાથે દુપકો બાંધી ફાંસ ખાઈ આપધાત કરી લીધો હતો. પ્રણવે ક્યા કારણોસર આપવાતનું પગલું ભર્યું તે અંગે હાલ રહસ્ય સર્જાયું છે. પાલ પોલીસે ચોક્કસ કારણ જાણવા વધુ આગળની તપાસ હાથ ધરી છે.

અંબાજી મંદિરમાં બેસતા વર્ષે સવારે 6થી રાત્રે 9 સુધી દર્શન » બેસતા વર્ષે છપ્પનભોગ

અન્નકૂટ ધરાવવામાં આવર્શ, મંગળા આરતી

સવારે 6 વાગ્યે થશે

on આંબાજ મંદિરમાં દિવાળી ૧ નવેશ્બરે ઇજવવામાં આવશે અને બેસતુ વર્ષ બીજી નવેશ્બરે ઇજવવામાં આવશે. નવા વર્ષના પ્રારંભે બેસતા વર્ષે અંબાજી મંદિરમાં માતાજીની ગાદી તરફથી છપ્પન ભોગનો અન્નકૃટ પણ ધરાવવામાં આવશે. જેના વિશેષ દર્શન શ્રદ્ધાળુઓ કરી શકશે. છપ્પન ભોગ અન્નકૂટ બપોરે ૧૨,૦૦ કલાકે રાજભોગ સાથે પરાવવાનો હોઈ સવારે મંદિર ૧૧.૩૦ કલાકે મંગળા કરવામાં આવશે અને કરી રાજભોગ અને અન્નકૂટ ની વિશેષ આરતી સાથે આવે છે. મંદિરમાં તહેવ બપોરના દર્શનનો પ્રારંભ થશે. બેસતા રોશની કરવામાં આવી છે.

બેસતા વર્ષ ૦૨/૧૧/૨૦૨૪ સવારે આરતી ૦૬.૦૦થી ૦૬.૩૦ સુધી થશે. બાદમાં દર્શનાર્થીઓ ૦૬.૩૦ વરા, ખાંડમાં કર્યાનાથાં બાં છેક.૩૦ મી ૧૧.૩૦ સુધી દર્શન ૧૨.૩૦થી ૪.૩૦ સુધી કરી શકાશે, ત્રીજથી આરતી સવારે ૬.૩૦થી ૭.૦૦ દરમિયાન થશે, બાદમાં દર્શનાથીઓ ૦૭.૦૦ થી ૧૧.૩૦ સુધી દર્શન કરી શકાશે.સાંજે આરતી ૮.૩૦ થી ૭.૦૦ સાંજે દર્શન ૭.૦૦ થી રાત્રીના ૯.૦૦ કલાક સુધી થશે.

કલાક સુધી થશ. દિવાળી, બેસતા વર્ષ સહિતના તહેવારોમાં 51 શક્તિપીઠ પૈકીના એક એબાજી મંદિરમાં મોટીસંખ્યામાં દર્શનાર્થીઓ ઉમટી પડતા હોય છે. મંદિર દેવસ્થાન ટ્રસ્ટ હારા તમામ પ્રકારની સુવિધાઓ ઊભી કરવામાં આવે છે. મંદિરમાં તહેવારોને લઈ

Essen Speciality Films Limited

પોસ્ટલ બેલોટ નોટિસ તથા ઈ-વોર્ટિંગ માફિતી

પાસ્ટલ બલીટ નાહિસ તથા છે -વાહિસ પૂર્ણ (બલીટના) માહિતા આદી નોહિસ આપવામાં આવે છે કે કંપની અ અધિનયમ ૧૦૧ કુ સુધારા મુજબ (અધિનયમ*)ની કલમ ૧૧૦ અને અન્ય લાગું જોગવાઈઓ અનુસાર, કંપનીજ (મેનજમન્ટ એન્ડ એડમિનિસ્ટ્રેશન) નિયાન ૧૦૧ કર્યો કરાયેલ સામાન્ય પરિવર્ગન ૧૪,૪૨૦૦ નાસીખ કર્યો કહ્યા ૧૦૦ કરાયેલ ૧૪,૪૦૦ કરાયેલ

સિક્કોરિટીઝ બેન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા (બિસ્ટિંગ ઓબ્લિગેશન્સ એન્ડ ડિસ્ક્લીઝર રિકલાયરપેન્ટ્સ) રેગ્યુલેશન્સ, ૨૦૧૫ના રેગ્યુલેશન ૪૪ના અનુપાલનમાં ('બિસ્ટિંગ રેગ્યુલેશન્સ') અને અધિનિયમની કર્યા ૧૦૮ અને ૧૧૦ની જોગવાઇએ. તેના ફેઠળ ધડવામાં આવેલ નિયમો સાથે વાંચતા અને એમસીએ પવિચાર, સ્થિતિ કરાવ પર મતદાન ૧૬વાની રીત માત્ર પં-લીટિંગ સુધી મર્ચાદિત છે એટલે કે. પોસ્ટલ બેલેટ શ્રીમાં સબપિટ કરવાન બદલ ઇરિક્ટીનિક રીતે મત આપવો. તદાનુશાર, પોસ્ટલ બેલેટ નોર્ટિસ અને ઇ-વીટિંગ માટેની નીટિંગ ફરતા તે સબ્લોન્જ ઇરિક્ટીનિક ક્રોલ ક્રારા મોકલવામાં આવી રહી છે જેમનું ઈમેલ એફેસ કંપની/દેપોઝિટરી પાર્ટિસિપન્ટસ સાથે નીપાયેલ છે.

ભારામાંના લિયા ૨૦ અને ૨૨ તિસ્ટિંગ રેગ્યુંલેશન્સના રેગ્યુંલેશન ૪૬ અને એસએસ-૨ સાથે વાંચેલા અધિનિયમની કલમ ૧૦ અને કલમ ૧૧૦ની જોગવાઈઓનું પાલન કરીને, કંપની તેના સલ્ચોને ઈ-વોટિંગ સુવિધા પૂરી પાડવા માટે ખુશ છે, જેથી તેઓ ઇલેક્ટ્રોનિક રીતે મતદાન કરી શકે. ઇ-વોટિંગના સંદર્ભમાં વિગતવાર પૃક્રિયા પોસ્ટન બેલ્દ્રને નીટિંગના સંદર્ભમાં ઉલ્લોગત છે. કપનીએ ઇ-વોટિંગનો સુવિધા મોં બિગશેર સર્વિસીંગ પ્રાઇવેટ લિમિટેડ (બિગશેર) ની સેવાઓ લીધી છે. કપનીએ બેગશેર સર્વિસીંગ પૂર્ણવેટ લિમિટેડ, રજિસ્ટ્રાર અને શેર ટ્રાન્સર જેજન્ટ ('આરટીએ') સાથે સલ્ચોને તેમના ઇ-સેલ એક્રેસની નીપાલી કરાવવા માટે સક્ષમ બનાવવા માટે જુરી વ્યવસ્થા કરી છે. જે સભ્યોએ ઠ્રજુ સુધી તેમનું ઇ-મેલ એફ્રિસ જેક્સર કરાવ્યું નથી તેઓને પોસ્ટલ બેલેટ નીટિંસમાં દર્શવેલ પહિલ્યોને અનુસ્ટીને તેની નીપણી કરાવવા વિનેતી છે.

ઇ-વૉર્ટિંગની સમયગાળી બુધવાર, 30 ઓક્ટોબર, ૨૦૨૪ના રોજ સવારે ૯.00 વાગ્રો (ભારતીય સ્થાનિક સમય પ્રમાણે શરૂ શકે અને ગુરુવાર, ૨૮ નહેમ્પર, ૨૦૪૪ના રોજ સાંજ પ૦૦ વાગ્રે (ભારતીય શ્લોકિક સમય પ્રમાણે) કામાન્ય શકો દેવાંગ્લિંગ પ્રક્રિયા ચાર તેમના મત્તનો ઉપયોગ કરવા ઇચ્છતા સબ્લોને ચિનતો કરવામાં આવે છે કે તેઓ પીસ્ટલ બેલેટ નીટિસમાં દર્શાવેલ સુસનાઓને કાળજુપર્વક વાર્ચ અને સુચાનાના ભાગ રૂપે બનેલી નોંધીમાં જુણાવ્યા મુજબ પૃથીઓ બન્યુસ્તીને તેમની સુમતિ (FOR) અથવા અમેમનિ (AGAINST) રેલેડ કેરે. આ સમયગાળા દરમિયાન, ૧૯-વોડ્ડ તારીએ બેટલે કેર પ્લોક્ટોલર, ૨૦૪૪ના રોજ કેપનીના શેરચાલ્ય કોલ્સ્ટ્રોનિક રીતે મનો મત આપી શકે છે. બિગશેર બ્રારા ઇ-વૉર્ટિંગ મોડ્યુલ ત્યાર બાદ મતદાન માટે અક્ષમ કરવામાં આવશે.

ઈ-વોટિંગની ચકાસણી પૂર્ણ થયા પછી સ્કૃટિનાઈઝર તેમનો ઉપોર્ટ ચેરમેન અથવા ચેરમેન ઘ્રાર અધિકૃત કોઈપણ વ્યક્તિને સુપરત કરશે અને પોસ્ટલ બેલેટ ઘ્રાર ઈ-વોટિંગના પરિણામ ઈ-વોટિંગની સમાપિતા ૪૮. કલાંક પછી જાઈર કરવામાં આવશે અને કંપનીની વેબસાઈટ https://www.essenspeciality.com\u2. બિગશેરની વેબસાઈટ https://ivote.bigshareonline.com પરે પહું દર્શાવવામાં આવશે અને મેશનલ સ્ટીક એક્સચેન્જ ઓફ ઈક્ટિંગ્રા વિમિટેડને જાણ કરવામાં આવશે થ્યાં કંપનીના શેર વિસ્ટિંગ

ઈ-વોર્ટિંગ સંબંધિત કોઈપણ પશ્ચેના કિસ્સામાં, તમે https://ivote.bigshareonline.com પર ઉપલબ્ધ વારવાર પાઝાતા પશ્ચી (FAQS) અને ડાઉનલીડ વિભાગ હેઠળ -Vote ઈ-વોર્ટિંગ મોડ્યુલનો સંદર્ભ તર્જો શકો છે એ ચ્યાવા તમે ivote@bigshareonline.com પર ઇમેઇન્ડ અથવા ૧૮૦૦ ૨૨ પશ્ચ ૨૨ પર કોલ કરી શકો શો.

એસેન સ્પેશિયાલિટી ઉલ્લ્સ લિમિટેડ વર્તી (અગાઉ એસેન સ્પેશિયાલિટી ફિલ્મ્સ પાઇવેટ લિમિટેડ તરીકે ઓળખાતી)

તારીખ ઓક્ટોબર રહ ર૦૨૪

epaper.navgularatsamav.com